

અઅમાલે રોઝે આશુરા

૧. ૧૦૦૦ વખત સુરએ કુલ હુ વલ્લાહુ અહદ
૨. ૧૦૦૦ વખત અલ્લાહુમ્મલ અન કતલતલ હુસયનિ અલરહિસ્સલામ
૩. ૪ રકાત નમાઝ ખે ખે રકાત કરીને, નીચેની રીત મુજબ પડવી:-

૧ઠી રકાતમાં હમ્દ પછી સુરએ કુલ યા અર્યુહલ કાફિરન

૨જી રકાતમાં હમ્દ પછી સુરએ કુલ હુ વલ્લાહુ અહદ

૩જી રકાતમાં હમ્દ પછી સુરએ અહઝાખ (જુઓ ૨૨મો સિપારો)

૪થી રકાતમાં હમ્દ પછી સુરએ મુનાફિકીન (જુઓ ૨૮મો સિપારો)

૪. આગળ અને પાછળ પગલા ઉપાડતી વખતે નીચે મુજબ પડવું:-

ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઇલરહિ રાજિઊન રિઝ્ઝિફ્ઝાઝહિ વતસ્લીમન શિ અમરિહ

૫. ટાઢુલ મઆદની દુઆ

૬. ઝિયારતે આશુરા ૧૦૦ વખત લઅનત અને ૧૦૦ વખત સલામ સાથે, ખે રકાત નમાઝે ઝિયારત અને દુઆએ અલકમા

૭. ઝિયારતે તાઅઝિયા

આશુરાનો દિવસ ગમનો દિન છે તે દિવસે દુનિયાના કામકાજમાં શુંથાવતું નહિ. ખલકે ગરબીન અને ઉદાસ રહી મજલીસોમાં હાજરી આપવી, સાંજ સુંઘી ફાકામાં રહેવું અને સાંજના ઈફતાર કરતી વખતે સાદી ખોરાક ખાવી.